



May 29, 2023

To,
General Manager
The Bombay Stock Exchange Limited
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street, Fort
Mumbai
Maharashtra 400001

Subject : Submission of newspaper copies of publication of Audited Standalone and Consolidated Financial results for the quarter and year ended March 31, 2023

Company Code : 540728

ISIN : INE327G01032

Dear Sir,

In terms of Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 the Company has published Extract of statement of Audited Standalone and Consolidated Financial results for the quarter and year ended March 31, 2023, which have been considered, approved and taken on record by the Board of Directors, at their meeting held on May 24, 2023.

The said financial results have been published in 'Business Standard' English edition and in 'Jai Hind' Gujarati edition dated May 27, 2023.

Further, in pursuance of Regulation 30(4) please find below enclosed copy of Newspaper articles as published in above mentioned newspapers.

Kindly take the same on your record and acknowledge receipt

Thanking You,

For, Sayaji Industries Limited

(Rajesh H. Shah)
Company Secretary &
Sr. Executive Vice President

Encl.: As above

Union Bank of India - 150 Ft. Ring Road Branch
 Nakhtrah - 1, Arun Mars Crossing, 150 Ft. Ring Road, Rajkot.

(Rule 8 (1)) POSSESSION NOTICE (for Immovable Property)

Whereas, the undersigned being the authorized officer of the Union Bank of India, 150 Ft. Ring Road Branch under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13 (2) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued Demand Notice Dated 06/03/2023 Calling upon the Mr. Vinod Ramji Rathod & Mrs. Bhavna Vinod Rathod to repay the amount mentioned in the notice being Rs. 6,33,202.10/- (Rupees Six Lakhs Thirty Three Thousand Two Hundred Two & Paise Ten Only) together with interest within 60 days from the date of receipt of the said notice.

The Borrower as well as Guarantors having failed to repay the total amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken/received Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him/her under section 13(4) of the said Act read with rule 8 of the said Rules of the said Act on this 24th Day of May of the year 2023.

Borrower/Guarantor's attention is invited to provisions of sub-section (8) of section 13 of the said Act, in respect of time available to redeem the secured assets. The Borrower/Guarantors in and before the public in general is hereby cautioned not to deal with the properties which are subject to the charge of the Union Bank of India 150 Ft. Ring Road Branch, Rajkot for not amount Rs. 6,33,202.10/- (Rupees Six Lakhs Thirty Three Thousand Two Hundred Two & Paise Ten Only) as on 29/01/2023 and further interest and expense thereon.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY
 Residential Flat No.504, LIG - 2, Gujarat State housing board project, Rangoli Park, Motamva Kalavad Road, P. No. 18, T. P. No. 22 of R. No. 18/09, Rajkot, in the name of Mr. Vinod Ramji Rathod, Addressing Area 46.00 Sq. Mtr. Rounded: -

On the North By: Flat No. N/501 On the East By: Internal Road at Ground Level
 On the South By: Flat No. N/503 On the West By: Lift

Date: 24.05.2023. Authorized Officer,
 Place: Rajkot. Union Bank of India

M/S. SHREE HARI CHEMICALS EXPORT LTD.
 Regd. Office: A/8, MIDC, Industrial Area, Mahad Dist: Raigad (Maharashtra)
 CIN: L99999MH1987P024542. Telle: 02145-234362.
 e-mail: info@shreeharicheicals.in, website: www.shreeharicheicals.in

AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31st March, 2023
 (₹. In Lacs) (Except EPS)

Particulars	QUARTER ENDED		YEAR ENDED	
	31.03.2023	31.12.2022	31.03.2023	31.03.2022
	AUDITED	UNAUDITED	AUDITED	AUDITED
1. Income From Operation (Net)	3,095.06	3,918.84	2,562.80	10,257.50
2. Net Profit/(Loss) From Ordinary Activities (Before Tax, Exceptional And Extraordinary Items)	-174.77	-1,265.78	3.91	-2,644.92
3. Net Profit/(Loss) For The Period Before Tax (After Extra Ordinary Items)	-174.77	-1,265.78	3.91	-2,644.92
4. Net Profit/(Loss) For The Period After Tax (After Extra Ordinary Items)	-174.77	-1,265.78	3.91	-2,644.92
5. Total Comprehensive Income After Tax	-106.90	-967.57	-4.41	-1,960.94
6. Paid Up Equity Share Capital (Face Value ₹ 10/- Each)	444.63	444.63	444.63	444.63
7. Earning per share (₹. 10/- each)				
Basic:	-2.40	-21.76	-0.10	-44.10
Diluted:	-2.40	-21.76	-0.10	-44.10

Notes:
 1. The financial results of the Company have been prepared in accordance with the Companies (Indian Accounting Standard) Rules 2015 (IND-AS) prescribed under section 133 of the Companies Act, 2013 and other recognized accounting practices and policies to the extent applicable.
 2. The above results have been reviewed by the Audit Committee and subsequently approved by the Board of Directors at its meeting held on May 25, 2023.
 3. The Company operates in a single business segment and therefore, has only one reportable segment in accordance with Ind AS 108 "Operating Segments".
 4. The figures for the previous period has been regrouped/reclassified, wherever necessary in order to conform to the current grouping/classification.

By Order of the Board
SHREE HARI CHEMICALS EXPORT LTD.
 B. C. AGRAWAL
 CHAIRMAN & MANAGING DIRECTOR
 [DIN: 001211080]

Place: Mumbai
 Date: May 25, 2023

SAYAJI SAYAJI INDUSTRIES LIMITED
 P.O. Kathwada, Maize Products, Ahmedabad-382430
 Website: www.sayajigroup.in • CIN : L99999GJ1941PLC000471

EXTRACT OF CONSOLIDATED AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31st MARCH, 2023
 (₹. In Lakhs unless otherwise stated)

Sl. No.	Particulars	Quarter ended		Year ended	
		31-03-2023 (Audited)	31-12-2022 (Unaudited)	31-03-2023 (Audited)	31-03-2022 (Audited)
1	Total income	27038.87	26689.58	24052.77	104988.11
2	Net Profit/(Loss) for the period / year (before tax and exceptional items)	(275.77)	610.22	596.27	421.72
3	Profit/(Loss) in share of joint venture	165.23	161.67	49.32	422.33
4	Profit/(Loss) for the period / year before tax	(110.54)	771.89	645.59	844.05
5	Profit/(Loss) for the Period / year after tax	(12.37)	549.82	406.56	694.45
6	Total Comprehensive Income (Loss) the Period / year	(38.08)	537.06	320.60	1732.52
7	Paid-up equity share capital (Face Value of Rs. 5/- each)	316.00	316.00	316.00	316.00
8	Other equity excluding revaluation reserves as at March 31, 2023 and March 31, 2022	-	-	11253.15	10730.75
9	Earning per share (face Value of Rs. 5/- each) (not annualized except for the year ended March 31, 2023 and March 31, 2022)				
	Basic (in ₹.)	(0.07)	8.81	6.45	11.42
	Diluted (in ₹.)	(0.07)	8.81	6.45	11.42

Notes:
 1. Additional information on stand-alone financial results is as follows:
 (₹. In Lakhs unless otherwise stated)

	Quarter ended		Year ended	
	31-03-2023 (Audited)	31-12-2022 (Unaudited)	31-03-2023 (Audited)	31-03-2022 (Audited)
Total Income	26936.32	25412.69	23401.63	76917.02
Net Profit/(Loss) before tax	129.57	636.35	912.65	2958.51
Net Profit/(Loss) after tax	217.73	406.79	413.80	721.65
Total comprehensive income (Loss) for the period/year	192.80	393.78	325.37	587.02

1. The results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at its meeting held on May 24, 2023. The statutory auditors have conducted audit on these financial results and have issued an unmodified opinion on the same.
 2. Figures for the quarter ended 31st March, 2023 are the balancing figures between the audited figures of the year ended 31st March, 2023 and the reviewed year-to-date figures for the nine months ended 31st December, 2022.
 3. The above is an extract of the detailed format of financial results for the quarter and year ended 31st March 2023 filed with the BSE Ltd. under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the same, alongwith notes are available on www.bseindia.com and on company's website www.sayajigroup.in.
 4. The figures for the previous period year have been regrouped/rearranged to make the same comparable with current period/year figures.

For and on behalf of Board of Directors
Vishal Priyam Mehta
 Executive Director
 DIN : 02690946

Place: Ahmedabad, Gujarat
 Date: May 24, 2023

MANGALAM INDUSTRIAL FINANCE LIMITED
 CIN : L65993WB1983PLC035815

Regd. Off: Old Nimra Road, Nandan Nagar, Beghona Kolkata-700053, West Bengal, In.
 Corporate Off: Hall No. 11, P. No. West to Milestone Bina Bhari Road, Vedaia, Sak. B. 4110
 Tel. No. +91 7202480001 Email: compliance@mifindia.com Website: www.mifindia.com

Extract of Standalone Audited Financial Results for the Quarter and Year Ended 31st March, 2023 (in Lakhs)

Particulars	Quarter ended		Year ended	
	31-03-2023 (Audited)	31-12-2022 (Unaudited)	31-03-2023 (Audited)	31-03-2022 (Audited)
Total Income from Operations	37.12	36.01	17.40	133.22
Net Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	496.74	14.19	103.00	489.08
Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	496.74	14.19	103.00	489.08
Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	499.25	14.19	71.84	400.94
Total Comprehensive Income for the period (Comprising profit/loss for the period (after tax) and other Comprehensive Income (after tax))	499.25	14.19	71.84	400.94
Equity Share Capital (No. of Shares)	9616.43	9616.43	9616.43	9616.43
Face Value (₹)	4762.10	4762.10	4762.10	4762.10
Reserves (including Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of previous year	-6277.83	-6277.83	-6277.83	-6277.83
Earnings Per Share (₹ of ₹1/- each) (for continuing and discontinued operations)				
Basic: (₹ Not annualised)	0.051	0.001	0.007	-0.052
Diluted: (₹ Not annualised)	0.051	0.001	0.007	-0.052

Notes:
 1. The Statement of Audited Financial Results for the Quarter and Year Ended 31st March, 2023 have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on 25/05/2023.
 2. These Financial Results have been prepared in accordance with the Indian Accounting Standard (Ind-AS) prescribed under section 133 of the Companies Act, 2013, read together with the Companies (Indian Accounting Standard) Rules, 2015 (as amended) and requirements of Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (as amended) and the requirements of Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (as amended) and the requirements of Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (as amended).
 3. The previous period figures have been regrouped/reclassified wherever required to conform to the current year's presentation.
 4. There are no qualifications in the Audit Report issued by the Auditor.
 5. The figures for the current Quarter Ended March 31, 2023 and Quarter Ended March 31, 2022 are the balancing figures between the Audited figures for the Year Ended March 31, 2023 and March 31, 2022, respectively and published figures for the nine months ended December 31, 2022 and December 31, 2021, respectively, which were subjected to limited review.
 6. The Companies business activity falls within a Single Operating Segment as per IAS 18.
 7. No investor complaints remain pending at the Quarter Ended on 31st March, 2023.
 8. Impairment Allowance on outstanding amount of loans and advances at the 5.38% / 14.20% on Loan amount of ₹ 12,75,89,000/-, 100% on Loan amount of ₹ 3,38,14,120/- (Since there is no recovery during the period) and 0.25% on Loan amount of ₹ 4,47,73,000/-. So during the year provision has been made of ₹ 2,34,30 Lakhs.
 9. Addition in PPE of ₹ 3.60 Lakhs and Intangible Assets of ₹ 17 Lakhs during the Quarter April 22 to March 23.

For MANGALAM INDUSTRIAL FINANCE LIMITED
 Venkata Ramana Revuru
 Managing Director
 DIN: 02939108
 Place: Vadodra
 Date: 25.05.2023

Tamilnad Mercantile Bank Limited
 Ringroad Branch : Plot No.25/C, 25/D & 25/E Ground Floor, Animesh House, Kinnary Cinema, Ringroad Branch, Surat - 395002, Gujarat
 Email:-surat_ringroad@tmbank.in, Phone No.0261-2366500, 2367600

Auction Notice for Sale of Immovable Properties

Auction Sale Notice for Sale of Immovable Assets mortgaged / charged to the Bank under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with provision to Rule 8 (6) and 9 (1) of the Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) M/s. Bhavna Textile, Proprietrix: Mrs. Vaghaysha Bhavnaben Harsukhbhai, W/o.Vaghaysha Harsukhbhai Laljibhai and the Guarantor Mr. Vaghaysha Harsukhbhai Laljibhai, S/o.Vaghaysha Laljibhai Guarantor Mr.Thummar Nareshbhai Dhruvhai, S/o.Dhruvhai Lakhanabhai Thummar, that the below described immovable properties mortgaged / charged to the Secured Creditor and the constructive possession of which has been taken by the Authorized Officer of Tamilnad Mercantile Bank Limited, Ringroad Branch, (Secured Creditor), will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" on 19.06.2023, for recovery of, Rs. 1,05,89,115.51 (Rupees One Crore Five Lakhs Eighty Nine Thousand One Hundred Fifteen and Paise Fifty One Only) as on 30.04.2023 due to Tamilnad Mercantile Bank Limited, Ringroad Branch with subsequent interest and expenses.

The Reserve Price for property No. 1 will be Rs. 10,80,000/- and the earnest money deposit will be Rs. 1,08,000/- The Reserve Price for property No. 1 will be Rs. 26,00,000/- and the earnest money deposit will be Rs. 2,66,000/-

Place of Auction Tamilnad Mercantile Bank Ltd Plot No.25/C, 25/D & 25/E Ground Floor, Animesh house, Kinnary Cinema, Ringroad Branch, Surat - 395002, Gujarat. Email:-surat_ringroad@tmbank.in, Phone No.0261-2366500, 2367600

Date and Time of Auction Sale 19.06.2023 and 12.00 P.M

1. On equitable mortgage of undivided share in land and commercial building Shop No. B-109 constructed thereat to the extent of 418.00 Sq. ft. or 38.84 Sq.m (Super built up area) and 264.58 Sq. ft. or 24.59 Sq. mtrs (Built up area) and its carpet area measuring 247.58 Sq. ft. or 23.01 Sq.mtrs on 1st floor of building no. B at "Mark Point" constructed on the land bearing Final Plot No. 172, TP Scheme No. 69 (Godadara-Dindoli) Block No. 203, Revenue Survey No. 128/2 of village: Dindoli, Sub-dist. Surat City, Dist. Surat standing in the name of Harsukhbhai Laljibhai Vaghaysha. Boundaries: South: Staircase, North: Shop No-B-110, East: Shop No-B-108, West: Pratik Vaghaysha.

2. On equitable mortgage of undivided share in land and commercial building shop No. C-021 constructed thereat to the extent of 700.00 Sq. ft. or 65.05 Sq.m (Super built up area) and measuring 386.06 Sq. ft. or 35.88 Sq. mtrs (Built up area) and its carpet area measuring 378.85 Sq. ft. or 35.21 Sq.mtrs on Ground floor of building no. C at "Mark Point" constructed on the land bearing Final Plot No. 173, TP Scheme No. 69 (Godadara-Dindoli) Block No. 204, Revenue Survey No. 128/1 of village: Dindoli, Sub-dist. Surat City, Dist. Surat standing in the name of Harsukhbhai Laljibhai Vaghaysha. Boundaries: South: Passage, North: Shop No-C-22, East: Shop No-C-20, West: Staircase

For detailed terms and conditions of the sale, please refer to the link provided in secured creditors website (www.tmb.in).

Authorized Officer
Tamilnad Mercantile Bank Ltd
 Ahmedabad Regional Office
 (For Ringroad Branch)
 Place: Surat
 Date: 26.05.2023

DIAMINES AND CHEMICALS LIMITED
 CIN No: L24110GJ1976PLC002905
 Registered Office: Plot No. 13, PCC Area, P.O. Petrochemicals, Dist. Vadodra - 391346.
 Phone : 0265 - 3534200 Fax : 0265 - 2230218
 Email : secretarial@dad.co.in Website : www.dad.co.in

NOTICE OF 47th ANNUAL GENERAL MEETING, E-VOTING INFORMATION & BOOK CLOSURE

Notice is hereby given that the 47th (Forty Seventh) Annual General Meeting (AGM) of Diamines and Chemicals Limited ("the Company") will be held at Registered office of the company situated at Plot No.13, PCC Area, P.O. Petrochemicals, Vadodra - 391 346, on **Wednesday, June 21, 2023 at 1:00 PM**, to transact Ordinary as well as Special business as set out in the notice of AGM dated May 08, 2023. The said notice along with proxy form, Attendance slip, e-voting communication and Annual report together with Audited Financial statements (Standalone & Consolidated) have been dispatched to all the members, at their registered address by Courier / Post and electronically to those members, who have their e-mail addresses registered with the Company / Depository Participant(s). The aforesaid notice along with, other documents are available on website of the company at www.dad.co.in and also available on the website of Link Intime India Private Limited at https://instavote.linkintime.co.in. The dispatch of notice of 47th AGM and Annual Report for the financial year 2022-23 has been completed on May 26, 2023.

As per Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 as amended and Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company is providing remote e-voting facility to its members to cast their vote by electronic means on all Resolutions set out in the Notice of AGM i.e. from a place other than venue of AGM, through e-voting services provided by Link Intime India Private Limited ("LIPL") on all the resolutions set forth in the Notice of 47th AGM. Members holding shares either in physical form or in dematerialized form, as on cut-off date of June 14, 2023, may cast their votes electronically on all the resolutions set forth in the Notice of 47th AGM.

All the members are hereby informed that:

REMOTE E-VOTING:

- It may please be noted that the Ordinary and Special Business as set out in the Notice of AGM will also be transacted by electronic means through remote e-voting service provided by LIPL.
- Members are requested to refer Notes forming part of notice of AGM dated May 08, 2023, regarding process and manner of remote E-voting.
- The cut-off date for the determining the eligibility to vote by remote e-voting at the AGM is June 14, 2023.
- The remote e-voting shall commence on **Saturday, June 17, 2023 (from 9:00 a.m. IST) and shall end on Tuesday, June 20, 2023 (5:00 p.m. IST)**. During this period, members may cast their vote electronically. The e-voting module shall be disabled by LIPL thereafter. The voting rights of members shall be in proportion to the equity shares held by them as on **June 14, 2023 ("Cut-off date")**. Any person who is a member of the company on the Cut-off date is eligible to cast vote on all resolutions set forth in the Notice of AGM.
- The facility of voting through poll will be provided at the AGM. The Members attending the meeting and those who have not cast their vote earlier by e-voting shall be able to vote at the meeting.
- A member may participate in the AGM even after exercising his right to vote through remote e-voting but shall not be allowed to vote again in the meeting.
- A member who is entitled to attend and vote in the meeting is also entitled to appoint a proxy to attend and vote instead of himself and a proxy need not be a member. The instrument appointing proxy should, however, be deposited with Registered office of the Company not less than Forty Eight hours before the Commencement of the Meeting.
- Any person, who acquires shares of the Company and becomes member of the company after dispatch of the Notice of the AGM and holding shares as on the cut-off date i.e., June 14, 2023 may obtain login id and password by sending a request at enotices@linkintime.co.in. However if a person is already registered with LIPL for e-voting then existing user id and password can be used for casting vote.
- In case the shareholders have any queries or issues regarding e-voting, you may refer the Frequently Asked Questions ("FAQs") and Instavote e-Voting manual available at <https://instavote.linkintime.co.in>, under Help section or write an email to enotices@linkintime.co.in or Call us : Tel : 0222-49186000. Members may also write to the Company Secretary of the Company at secretarial@dad.co.in or at the Registered Office of the Company.

BOOK CLOSURE :

- Notice is also hereby given pursuant to Section 91 of the Companies Act, 2013 and Regulation 42 of SEBI (Listing Obligations and Disclosure Requirements), Regulations, 2015, the Register of Members & Share Transfer Books of the Company will remain closed from **June 14, 2023 to June 21, 2023 (both days inclusive)** for the purpose of 47th AGM and payment of Final Dividend (if approved by the Members at the AGM).
- The members are requested to communicate all their correspondence to the Registrars & Share Transfer Agent M/s Link Intime India Pvt. Ltd. at B-102, V-103, Shangri-la Complex, First Floor, Opp. HDFC Bank, Near Radhakrishna Char Basta, Akota, Vadodra - 390 020 with Contact person Mr. Alpesh Gandhi at Email: vadodara@linkintime.co.in and Ph. No: 0265-6158000, 2366573.

Pursuant to Finance Act 2020, dividend income is taxable in the hands of shareholders w.e.f. April 1, 2020 and the Company is required to deduct tax at source from dividend paid to shareholders at the prescribed rates, if approved by the Shareholders in 47th AGM. For the prescribed rates for various categories, the shareholders are requested to refer to the Finance Act, 2020 and amendments thereof. The shareholders are requested to update their PAN with the Company's Registrar and Transfer Agent (in case of shares held in physical mode) and with relevant depository participant (in case of shares held in demat mode) on or before June 10, 2023. In case their PAN is not registered, the tax will be deducted at a higher rate of 20%. A Resident individual shareholder with PAN and who is not liable to pay income tax can submit a yearly declaration in Form No. 15G/15F, to avail the benefit of non-deduction of tax at source and Non-resident shareholders can avail beneficial rates under tax treaty between India and their country of residence, subject to providing necessary documents, i.e. No Permanent Establishment and Beneficial Ownership Declaration, Tax Residency Certificate, Form 10F, any other document which may be required to avail the tax treaty benefits, the details are available on website of the Company www.dad.co.in and RTA www.linkintime.co.in.

By Order of the Board
For Diamines And Chemicals Limited
Hemaji Pawar
 Company Secretary
 Membership No. A52581

Place: Vadodra
 Date: May 26, 2023

ISecure CREDIT & CAPITAL SERVICES LIMITED
 CIN : L18209WB1994PLC062173

Regd. Off: Old Nimra Road, Nandan Nagar, Beghona Kolkata-63, West Bengal, In.
 Administrative Off: First Floor, City Centre Building, Near, Thiruvaiyur, Kerala-680005,
 Vadodra-391410, Gujarat.
 Corporate Off: 1st Floor, City Centre Building, Near, Thiruvaiyur, Kerala-680005,
 Tel. No. +91 7574895589
 E-mail: compliance@iscslimited.com Website: www.orchidsecrredit.com

Extract of Standalone Audited Financial Results for the Quarter and Year Ended 31st March, 2023 (in Lakhs)

Particulars	Quarter ended		Year ended	
	31-03-2023 (Audited)	31-12-2022 (Unaudited)	31-03-2023 (Audited)	31-03-2022 (Audited)
Total Income from Operations	21.87	22.86	25.66	88.51
Net Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	-38.84	2.82	21.98	-26.76
Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	-38.84	2.82	21.98	-26.76
Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	-43.11	2.89	15.93	-34.10
Total Comprehensive Income for the period (Comprising profit/loss for the period (after tax) and other Comprehensive Income (after tax))	-43.11	2.89	15.93	-34.10
Equity Share Capital	1100.01	1100.01	1100.01	1100.01
Reserves (including Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of previous year	18.40	18.40	15.70	15.70
Earnings Per Share (₹ of ₹1/- each) (for continuing and discontinued operations)				
Basic: (₹ Not annualised)	-0.39	0.02	0.29	-0.31
Diluted: (₹ Not annualised)	-0.39	0.02	0.29	-0.31

Notes:
 1. The Statement of Unaudited Financial Results for the Quarter and Year Ended 31st March, 2023 have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on 26/05/2023.
 2. These Financial Results have been prepared in accordance with the Indian Accounting Standard (Ind-AS) prescribed under section 133 of the Companies Act, 2013, read with relevant rules issued thereunder.
 3. Figures of previous period have been regrouped/rearranged/reclassified where necessary to conform to current period's classification.
 4. The Statutory Auditors of the Company have carried out a "Limited Review Report" of the above Results as per Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.
 5. There are no investors complaint remains pending at the Quarter Ended on 31st March, 2023.
 6. There are no qualifications in the Audit Report issued by the Auditor.
 7. The figures for the current Quarter Ended March 31, 2023 and Quarter Ended March 31, 2022 are the balancing figures between the Audited figures for the year ended March 31, 2023 and March 31, 2022, respectively and published figures for the nine months ended December 31, 2022 and December 31, 2021, respectively, which were subjected to limited review.
 8. Impairment Allowance on outstanding amount of loans and advances at the 10% on Loan amount of ₹ 63,03,56,947.11, 100% on Loan amount of ₹ 62,30,000/- (Since there is no recovery during the period) and 0.25% on Loan amount of ₹ 14,82,44,000/-. So during the year provision has been made of ₹ 51,15 Lakhs.
 9. Based on the guiding principles given in Ind-AS 108 on "Operating Segments", the Company's business activity fall within a single operating segment, namely Finance & related activities.
 10. Total amount raised was ₹ 80,00,00,000/- Out of which 25% of the amount i.e. ₹ 20,00,00,000/- has been received and utilized by the company in the FY 2022-23 balance 75% of the amount i.e. ₹ 60,00,00,000/- has been received by the company towards convertible warrants on preferential basis in FY 2022-23 and the same has been fully utilised during the year as under:-

Original Object	Opening	Units Utilised	Balance	Remarks if any
Used as per object of preferential issue which includes: Financing, working capital requirements, general corporate purpose and temporary lending of loans and advances.	3432872	3432872	0	There has been no modification to the original purpose and temporary lending of loans and advances.

11. The above financial results are also available on the Company's website <http://www.orchidsecrredit.com> and MSEI's website www.mse.in

For and on behalf of the Board
For Isecure Credit & Capital Services Limited
 (Formerly known as Orchid Securities Limited)
 Sagan Avinash
 Director
 DIN: 09593791
 Place: Vadodra
 Date: 26.05.2023

MEGHA SASTRA Centre : 1st Floor,
 Circle Tower, Station Road, Surat,
 Gujarat, Ph: 0261-2454343
 email: cs@323@tmb.in

**Appendix-I (See Rule 8(1))
 POSSESSION NOTICE
 (For immovable Property)**

Whereas, the undersigned being the Authorized Officer of the Punjab National Bank under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (Second) Ordinance, 2002 (Ord. 3 of 2002) and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, issued a demand notice dated as mentioned below calling upon the respective borrowers/guarantor to repay the amount mentioned against each account within 60 days from the date of notice (date of receipt of the said notice).

The borrowers/guarantors in and before the public in general is hereby cautioned not to deal with the property which has been taken by the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under section 13(4) of the said Act read with Rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002.

The Borrowers/Mortgagor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the properties which will be subject to the charge of the Punjab National Bank for an aggregate amount and interest thereon.

The borrowers/guarantors/mortgagors attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act in respect of time available to redeem the secured assets.

No.	Name of the Branch	Name of the Account	Description of the Property Mortgaged And Type of Possession	Date of affixture of possession and Date of demand notice
1.	PNB : Valsad	Mr. Arunkumar Omkarnath Tiwari (Borrower) and Mr. Dilip Kumar Ramnarayan Mishra (Guarantor)	EM of Residential Flat No. 403 Third Floor, Shivam Complex measuring 850 sq.ft. super building (78.99 sq.mtrs) is constructed on N Plot No. M-8 & M-	

